

ગુજરાત વિધુત નિયંત્રક આયોગ, ગાંધીનગર

પ્રેસ નોટ

તા:૩૧/૦૩/૨૦૨૨

રાજ્ય સરકાર હસ્તકની વિજ ઉત્પાદન, વિજ પ્રવહન, વિજ વિતરણ કંપનીઓ તથા અન્ય વિજ વિતરણ કંપનીઓ દ્વારા જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું ટુ-અપ અને નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરેલ. સદર પીટીશનો જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં ઓડીટેડ હિસાબો સાથે આયોગના નિર્દેશ મુજબ દાખલ કરેલ. આ પીટીશનો ઇલેક્ટ્રીસીટી એક્ટ, ૨૦૦૩ અને સંલગ્ન વિનિયમો અનુસંધાને રજીસ્ટર કરી પ્રશુલ્ક આદેશ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ.

આ અરજીઓ જાહેર જનતાની ભાગીદારીની ખાતરી કરવા જાહેરમાં પ્રકાશિત કરવા કંપનીઓને નિર્દેશ આપવામાં આવેલ. સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી વાંધાઓ/સુચનો મંગાવવાની વિસ્તૃત કાર્યવાહી કરવામાં આવેલ. આ વાંધાઓ સુચનોની ચકાસણી કરીને ૧૫, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ નાં રોજ જાહેર સુનાવણી નિયત કરવામાં આવેલ. આ સુનાવણીમાં કેટલાક હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંગઠનો સહિત આ સુનાવણીમાં ભાગ લીધો હતો.

આયોગ દ્વારા આ અરજીઓ ના આદેશો તથા પ્રશુલ્ક નિર્ધારીત કરેલ છે અને આ આદેશોના મહત્વના/અગત્ય નાં મુદ્દાઓ નીચે મુજબ છે:

- રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિમીટેડ (અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તાર) કંપની ના ગ્રાહકો માટે ના વિજ દરમાં કોઇ વધારો કરેલ નથી.
- જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂ.૪૨૫૨.૩૭ પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસમાં નજીવો ઘટાડો કરી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ દર પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ રૂ.૪૦૪૭.૬૦ નિર્ધારિત કરેલ છે.
- ટુંકાગાળા માટે પ્રવહન દર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૩૫.૮૭ પૈસા પ્રતિ યુનિટ મંજૂર કરેલ છે.
- રાજ્ય વીજભાર રવાનગી કેન્દ્ર માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૨૬૪૩.૨૦ લાખ જે ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૧૪.૧૫ લાખના વર્તમાન ચાર્જ સામે મંજૂર કરવામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન પીજીવીસીએલ અને ટીપીએલ-સુરત સિવાયના અન્ય પરવાનેદાર માટે ખરેખર વિજ વિતરણ ઘટ આયોગ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યાંક કરતાં ઓછો આવેલ છે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો મંજૂર કરાયેલ વિજ વિતરણ ઘટ ના લક્ષ્યાંક નીચેના કોષ્ટક માં બતાવવામાં આવેલ છે:

ડિસ્કોમ	આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ ૨૦૨૧-૨૨	આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ ૨૦૨૨-૨૩
ઉત્તર ગુજરાત વિજ કંપની લી	૯.૦૦%	૭.૦૦%
દક્ષિણ ગુજરાત વિજ કંપની લી	૬.૫૦%	૬.૫૦%
મધ્ય ગુજરાત વિજ કંપની લી	૯.૦૦%	૯.૦૦%
પશ્ચિમ ગુજરાત વિજ કંપની	૧૬.૦૦%	૧૬.૦૦%
ટીપીએલ-અમદાવાદ/ ગાંધીનગર	૬.૨૪%	૬.૦૩%
ટીપીએલ - સુરત	૩.૫૪%	૩.૫૪%

રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપનીઓ માટે, આયોગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિજ ખરીદ ખર્ચ રૂપિયા ૪.૫૭ પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ. ૧.૯૦ યુનિટ ટીઠ મંજૂર કરેલ છે.

આયોગ દ્વારા ટોરેન્ટ પાવર લિમિટેડ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૮૮ પ્રતિ યુનિટ મંજૂર કરેલ છે, ઉપરાંત, અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર માટે તેમજ બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ.૨.૦૨ પ્રતિ યુનિટ મંજૂર કરેલ છે. જ્યારે સુરત માટે બેઝ એફપીપીપીએ રૂ.૧.૪૮ પ્રતિ યુનિટ મંજૂર કરવામાં આવેલ છે.

-સહિ-

રૂપવંત સિંહ (આઇએએસ)

સચિવ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
ગાંધીનગર